

24th July, 2024

To,
Corporate Relationship Department,
BSE Limited,
Floor 25, Rotunda Building,
Dalal Street,
Mumbai - 400 001.

SUB: Newspaper publication of Standalone Un-audited Financial Results for the

Quarter ended on 30th June, 2024

Scrip Code: 526711

Dear Sir/Madam,

We would like to inform you that, the Company has published on Saturday, 20th July, 2024 the Un-audited Standalone Financial Results for the Quarter ended on 30th June, 2024 in Western Times (English and Gujarati Edition).

The said Un-audited Standalone Financial Results are also available on the website of the Company at www.adarshplant.com

We submit herewith copies of said publication in the above newspapers, pursuant to the Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

Thanking you,
Yours faithfully

For Adarsh Plant Protect Limited

Ms. Dhwani Shah

Company Secretary & Compliance Officer

Encl: a/a







Susiness

Tata Motors redefines the mid-SUV category with India's first SUV Coupé Reveals the Curvy

Mumbai, Defining a new era in SUV design, Tata Motors, India's lead-ing automotive manufac-turer, today unveiled the Tata Curvv ICE and EV. Tata Curvv ICE and EV.
Born of powerful philosophy, form and function, the
Curvv is India's first SUV
Coupé. Exhibiting the
new-age SUV typology,
the Curvv artfully blends
the toughness and practicality of an SUV with the cality of an SUV with the elegance and sporty silhouette of a coupé. Launching on 7th August, the all-new Currv will follow Tata Motors' strong multi-powertrain strategy and will be first available in its EV version which will soon be followed by its ICE counterpart.

Commenting on the unveil, Mr. Shailesh Chandra, Managing Director,

unveil, Mr. Shailesh Chan-dra, Managing Director, Tata Motors Passenger Vehicles Ltd., and Tata Passenger Electric Mobil-ity Ltd., said, "Tata Motors has pioneered the Indian SUV arena. What's more is that we have repeated-ly disrupted the category

though innovative designs that deliver great road presence as well as enhanced functionality. The original Sierra, Safari, Nexon, Punch and Harrier are testament to this design led market leadership in SUVs. Taking this legacy forward and to further strengthen our SUV portfolio, we have once again broken the clutter in the effervescent and aspirational mid SUV category by introducing the Tata Curvy - India's first SUV coupe, a dispirational mid SUV category by introducing the Tata Curv - India's first SUV coupe, a dispirational mid SUV category by introducing the Tata Curv - India's first SUV cury - India's trategories, providing best in segment performance and never before seen practicality. Further, Curvv is at the forefront of our multi powertrain strategy, with options across Petrol, Diesel and Electric powertrains. With the Curvv we will address a wide variety of needs of the mid SUV customers, providing them with a fresh and delightful y designed product com-

veals the Curvy
plimented by premium
performance." The Curvy
is a perfect blend of stunining design that captivates,
practicality that empowers,
and performance that exhilarates. The Curv's SUV
coupé body style, in contrast to the conventional
boxy design that is common in the mid-SUV manket, carries over the strongand trainmine the conventional
boxy design that is common in the mid-SUV manket, carries over the strongand trainmine the deapth
show car, highlighting its
strong character to the
front and carrying it boldly
through the vehicle. The
raised ride height, tough
cladding, and dynamic proportions contribute to its
appeal. The Curv's sharpty sloping roofline allows it
to efficiently slice through
wind resistance, while its
large wheels, high approach and departure an
gle and balance give a planted
and balanced stance. The
SUV coupé will debut in
two new color shades: Virtual Sunrise in the Curv.veand Gold Essence in the two new color shades: Virtual Sunrise in the Curvv.ev and Gold Essence in the Curvv ICE.

Samsung Launches Galaxy Watch7, Watch Ultra, Buds3 Series in India

GURUGRAM, Samsung, India's largest consumer electronics brand, has announced exciting offers for consumers preordering its new Galaxy Buds3. Galaxy Buds1 Programs of Galaxy Match Ultra smartwatches. Galaxy Match Ultra expand the power of Galaxy Alt to more people through wearables designed to provide end-to-end wellness experiences for everyone.

Galaxy Match Ultra — the newest and most powerful addition to the Galaxy Watch portfolio — is designed for enhanced fitness experiences for next level achievements with ultmate intelligence and capabilities.

The Watch Ultra gets a

capabilities.

The Watch Ultra gets a The Watch Ultra gets a new cushion design to en-hance protection and visu-al completeness. It comes with Titanium Grade 4 frame and 10ATM water resistance and can operate

d, DUGSO JCII
at a wider range of altitudes
for advanced fitness experences like swimming in
the ocean to cycling in extreme environments.
With a newly added
Ouick Button, you can instantly initiate and control
workouts and map other
functions to suit your
resets in addition, you can
resets in addition you can
resets in addition you can

workouts and map other functions to suit your needs. In addition, you can activate an Emergency Si-ren for safety. Post-workout, check stats at a glance with dedicated watch factor of the safety. Watch Ultra 180 on suit of 3,000 nits, Galavy Watch Ultra also ensures readability even in bright sungipt. For peace of mind during longer adventures, Galaxy Watch Ultra watch Ultra lass on sures readability even in fight sungipt. For peace of mind during longer adventures, Galaxy Watch Ultra has the longest battery life within the Galaxy Watch line-up, offering up to 100 hours in Power Saving and 48 hours in Exercise Power Saving. Galaxy Watch Ultra will be available in a 47mm size in Titanium Gray, Titanium White and

Titanium Silver. Galaxy Watch Ultra comes with a 3nm chipset. With Galaxy Watch7, you can accurately track over 100 workouts and build routines by comly track over 100 workouls and build routines by combining various exercises with Workout Routine to achieve your goals. Receive a complete body and fitness snapshot with Body Composition for a comprehensive understanding of your day and ended to the proposition of a comprehensive understanding of your heart health with Electrocardiogram (ECG) and Blood Pressure (BP) monitoring, Customers who pre book the Galaxy Watch7 will get multi-bank cashback worth INR 8000 or upgrade bonus worth INR 8000 to upgrade bonus Bonus

pre book the Galaxy Watch Ultra will get multi-bank cashback worth INR 10000 or upgrade bonus worth INR 10000.

Luxury homes worth crores selling like hot cakes in India this year

According to the latest report by real estate consultant CBRE, India's tux-ury housing segment maintained strong sales growth, reaching total sales of around 8,500 luxury units compared to nearly 6,700 units in the same period of 200 units in Delhi-NCR surged 14 per cent to 3,300 units,

BOTH ARE SAME PERSON

JAYNEEL MAHENDRAKUMAR PATEL in my Aadhar Card, PATEL JAINIL MAHENDRABHAI in Election Card and JAYNEEL M PATEL (Son of: MAHENDRA) in

Driving License by mistake. I Solemnly declare and confir that my name Both are same that my name Both are same person and I known as IAYNEEL MAHENDRAKUMAR PATEL Address: 8, Rudravatika Societ

Sindhubhavan Road, Thaltej, Ahmedabad.

New Delhi, July 19
(IANS) Aligned with the declaration of the year cent to 2,500 units. Housing sales in H1 2024 due to the robust economy and growing demand at 3,300 units, up 44 per derived and sale of houses costing Rs 4 crore and above went up 27 per cent in the first half of this year.

According to the latest report by real estate consultant SHR. Included the consultant firm crease during this period. Including the consultant firm the same period of 2023.

Delhi-NCR, Numbai and Hyderabad accounted for nearly 48 per cent.

India, Suturb-East Asia. The same period in 2023. A total of the stall luxury housing sales and stove and and growing demand of the report by life sales in H1 2024 the formation of the properties priced at Rs 4 crore and above, is set to this same period of 2023.

Delhi-NCR, Numbai suw a growth of the properties priced at Rs 4 crore and above, is set to this same period in 2023. A total of 12023. A total of 1902 in H1 2024, the figure was 30 per cent in the same period in 2023. A total of 1902 in H1 2024, the figure was 30 per cent of the total luxury housing sales and the robust economy and growing demand for luxury lifestyles. The report from properties priced at Rs 4 crore and above, is set to this ame period of 2023. A total of 1902 in H1 2024, the figure was 30 per cent in the same period in 2023. A total of 1902 in H1 2024, the figure was 30 per cent in the same period in 2023. A total of 1902 in H1 2024, the figure was 30 per cent in the same period in 2023. A total of 1902 in H1 2024, the figure was 30 per cent in the same period in 2023. A total of 1902 in H1 2024, the figure was 30 per cent in the same period in 2023. A total of 1902 in H1 2024, the figure was 30 per cent in the same period in 2023. A total of 1902 in H1 2024, the figure was 30 per cent in the same period in 2023. A total of 1902 in H1 2024, the figure was 30 per cent report earlier this month revealed that the real es-tate market witnessed

crore sales in the first half of 2023, according to the report by India Sotheby's 'Internation-al Realty and CRE

Matrix'. The primary luxury segment saw sales worth Rs 8,752 crore, the second-best half-yearly sales value in the past five years.

WESTERN RAILWAY- RATLAM

SUPPY INSTALATION, AND
SUPPY INSTALATION, AND
COMMISSIONED OF CITY CAMES,
BECORRING-UMAIONITORING SISTE
SUBMERTAN, INSTALATION, AND
SUPPY INSTALATION, AND
SUPPY INSTALATION
REPS: 17-07-2024 (Open tender, SingleREPS: 17-07-2024 (Open tender, SingleBacket system) for the following vote
the date of opening happens to be
ARDIOI or Holdesty, the tender will
ARDIOI or Holdesty, the tender will
contain suppy in tender will
contain suppy installation, a
commissioning of CCTV camera
Recording-um-Montolping system Office of the Sr. DME (C&Wy)R FFICE, Ratlam division, ailway, Date & Time for sul nd opening of tender: Closi 5:00 Hrs. on 12.08.2024. Open 5:30 Hrs. on 12.08.2024. ander documents can also be purloaded from website of IREPS-pps.gov.in any other information quired by the tenderer can be obtained the office of Sr. DME/RTM, DRM FFICE, Ratlam division, Western allowed uting the unerline how per line.

SNP-154 Sr.DME(C&W) / R Like us on: **f** facebook.com/WesternR

SNP-152 Western Railw Like us on: f facebook.com/We

Business Brief III

Sensex. Nifty trade lower on weak alobal cues

wealk global cues

Mumbai, July 19 (IANS) Indian equity indices opened in the red on Friday following weak global cues from Asian peers. At 9:45 a.m., Sensex was at 81,196, down 146 points or 0.8 per cent and Nifty was down 75 points or 0.34 per cent. at 24,716. The broader market trend is negative. On the National Slock Exchange (NSE), 1661 shares are in red and 526 shares in green. Selling pressure is also seen in midcap and smallcap stocks. The Nifty Midcap 100 index is down 591 points or 1.03 per cent at 56,520 and the Nifty Smallcap 100 index is at 18,661 points, down 167 points or 0.89 per cent. Deven Mehata, Research Analyst at Choice Broking said, "Nifty can find support at 24,700 followed by 24,650 and 24,600. On the higher side, 24,850 can be an immediate resistance, followed by 24,900 and 25,000." on Thursday, Infosys reported a good number compared to estimates Infosys, Asian Paints, ITC, Nestle, HCL Tech, Kotak Mahindra Bank and LDFC Bank are the top gainers in the Sensex pack. Tech Mahindra, Tata Steel, Ultra Tech Cement, JSW Sleel and Wipro are the top losers. Steel and Wipro are the top losers.

Despite being halfway through the current solar cycle, Sun is starting next

New Delhi, July 19 (IANS) Even though the Sun is just halfway through its current cycle, the first rumblings of its next 11-year solar cycle have been detected in sound waves within it, accord-ing to a team of researchers. This current cycle is been detected in sound waves within it, according to a team of researchers. This current cycle is presently reaching lis apex, or solar maximum that occurs when the Sun's magnetic field flips and its poles swap places, until mid-2025. It impacts the Sun's surface activity, with sunspots, flares, and coronal mass ejections all increasing during solar maximum. This causes an increase in electromagnetic energy heading towards Earth, making aureas more visible and at lower altitudes. The current solar cycle, known as Cycle 25, began in 2019. It is not expected to end for another six years but researchers from the University of Birmingham have spotted the first signs that the next solar cycle is beginning. They presented the findings at the Royal Astronomy in Hull Dr. Rachel Hower enders the control of the solar cycle is beginning. They presented the find waves in the Sun, revealing bands of faster and slower rotation. This pattern, observed using helicosismic data from GONG, MDI, and HMI since 1995, shows faster-moving material driffing toward the Equator before each solar cycle starts.

WESTERN RAILWAY-RATLAM COMPREHENSIVE ANNUAL MAINTENANCE CONTRACT Radism, invites e-lenders to the followin work: Tender No.: EL/TRD/58/2024 25/01/RT. Date: 17/07/2024. Name of the work: TRD work in connection wit various S&T at different location of Radism Division. Estimated cost covers: 11,41,93,799,501. Earnes Money Deposit / Bid Security 222,100/4. Completion period: 1 Month, Cost of tender document: 3N Closing date and time: 12,08.2016

SNP-153 SnDEETROURTM On Date 12/08/202
Like us on: facebook.com/WesternRly Like us on: facebook.com/WesternRly

ADARSH PLANT PROTECT LIMITED Regd, Office: 861, GipC, VITHIAL UDVORAGAR - 388 121, DIST, ANANC CIN No. L229 (169) 1992 PL D17845

Audited 1865.18 48.60

GUJARAT LEASE FINANCING LTD.

(CIN: L65990GJ1983PLC006345)

Regd. Office: 6° Floor, Hasubhai Chambers, Opp: Town Hall, Ellisbridg Ahmedabad-380 006.
Ph: 079-26575722, E-mail: gliftho ahm@yahoo.co.in, Website: www.gujaratleasefinancing.co.in

EXTRACT OF THE STATEMENT OF UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2024

Sl. No.	Particulars	Quarter ended	Year ended	Quarter ended
		30.06.2024	31.03.2024	30.06.2023
		(Un-audited)	(Audited)	(Un-audited)
1	Total Income	10.27	48.01	10.15
2	Net Profit/(Loss) for the period before Tax and Extraordinary items	(6.16)	8.68	(6.28)
3	Net Profit/(Loss) for the period after Tax and Extraordinary items	(6.16)	8.68	(6.28)
4	Total Comprehensive Income for the period (after tax)	(4.15)	11.56	(6.46)
5	Equity Share Capital	2712.58	2712.58	2712.58
6	Reserves excluding Revaluation Reserve as per Balance Sheet	-	(3128.05)	-
7	Earnings Per Share (of ₹ 10/- each) Basic and Diluted	(0.02)	0.03	(0.02)

iote: The above is an extract of the detailed financial results for the quarter ended June 30, 2024 filed with the Note: The anovers is a textual to the equation Thanking issues to the quanties fement unless 0, 2022 in flex with interest Stock Exchanges and Orsichouser Requisition 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015. The full format of the same, along with the notes, is available on the website of Stock Exchanges at www.bssinfla.com and www.bssinfla.com and with companying septies at wave quantielases/financing.com.

Retail sales surge in India amid high disposable incomes, rising consumption

New Delhi, July 19 (IANS)As household con-New Delhi, July 19 (IANS)As household consumption expenditure on goods and services surged with rising disposable incomes, the country saw a significant 5 per cent growth in retail sales in the consumption of the consumpti

consumption
anticipate further improvement in consumer sentiment and retail sales, said
Kumar Rajagopalan CEO
of RAL. The report shall
are said sales, said
Anticipate said said said
a cross various sectors,
particularly in discretionary
items, boosted by end-ofseason sales According to
a recent survey by the Ministry of Statistics, household consumption expenditure on goods and servicesis rising in both rural and
urban areas. The monthly
per capita household consumption in rural India
jumped by over 40 per cent
in 2022-23, after adjusting
for inflation, compared to
the corresponding figure
recorded for 2011-12, according to the survey.

શ્રી ભાગવત વિધાપીઠ બી. એક્. કોલેજ, સોલા અમદાવાદ ભરતી માટેની જાહેરાત

ગુજરાત સરકારશ્રી દ્વારા સ્થાપિત તેમજ યું જી રાતે. માન્યતા પ્રાપ્ત શ્રો સોમનાથ સંસ્કૃત ચુબિરાસીટી, તેરાવળ સંવગ્ળ (સ્વબિર્ભર) શ્રી ભાગવત વિદ્યાપીઠ ળી.એફ. કોલેજ, સોલા, અમદાવાદ માટે સંસ્કૃત માદ્યમુમાં અદ્યાપન કરાવી શકે તેવા નીચે જણાવેલ જગ્યાઓ માટે ભારતીય નાગરિકો પાસેથી આવેદનપત્ર આમંત્રિત કરવામાં આવે છે

જગ્યાનું નામ :- (૧) આચાર્ય -૧ (૨) આસી. પ્રોફેસર જગ્યા-૧ (વિષય :- સંસ્કૃત વ્યાકરણ-૧)

સૂચનાઓ: (૧) નોકરી કરતા ઉમેદવારોએ સંસ્થાના વડા મારફત ્રુટ અરજુે. મોકલવી. (૨) ઉમેદવારે પોતાની અરજુ જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન- ર૧માં સંપૂર્ણ વિગતો સાથે રજી.એ.ડી.થી, શ્રી ભાગવત વિદ્યાપીઠ બી.એડ. કોલેજ. શ્રી ભાગવત વિદ્યાપીઠ બી.એડ. કોલેજ શ્રી ભાગવત વિદ્યાપીઠ, કૃષ્ણ ધામ, એસ.જી. હાઇવે, મુ. સોલા, અમદાવાદ ને મોક્લવાની રહેશે, સમય મર્ચાદા બાદ આવેલ અરજી અમાન્ય રહેશે.(3) અરજી કરવા માટેનું નિયત નમુનાનું ફોર્મ તથા જરૂરી સુચના www.sbvtbedcollege.org વેબસાઈટ પરથી મળશે. (૪) નિમણૂંક પામનાર ઉમેદવારને યુ.જી.સી./ સરકારશ્રી/ યુનિવર્સિટી તેમજ સંસ્થાના વખતોવખતના બધા નિયમો બંધનકર્તા

કા. આચાર્ચ શ્રી ભાગવત વિદ્યાપીઠ બી.એક્. કોલે૧ મું .સોલા, અમદાવાદ

Form No. URC-2
Advertisement giving notice about registration under Part I
of Chapter XXI of the Act. [Pursuant to section 374(b) of the
companies Act. 2013 and rule 41(b) of the companies (Alc 2013 and rule 41(b) of the companies Act. 2013 and rule 41(b) of the companies Act. 2013 and rule 41(b) of the companies Act. 2013. An application has been made to the
Registra of Quart Int 46 RS 24FEEL ACT MEM-EA. partnership fine
sa companyimited by shares happier XxI of the Companies Act 2013,
2. The principal objects of the companies Act 2013,
2. The principal objects of the companies Act 2013,

Registrar at Gujarat that MS SHNEEJ ACRI (IMPEX, a partnership imm may be mightered under Part of Chapter XXI of the Companies Act 2013.

2. The principal objects of the company are as follows:

1. To carry on the business to manufacture, produce, plant, grow, cultivate, ne-fill, import, export, buy, sell, process, prepare, crush and otherwise designing in edible and non-edible oils, obsessés, brans's, castor destructions of the company are as follows:

1. To carry on the business to media the company are as follows:

2. To carry on the business of manufacture, produced in interest oils, extraction of inseed, cotton seed, groundrut oil, fertilizer mixtures, hydrogenated caster oil, oil and primareacutical, groundrut cakes, my hydrogenated caster oil, oil and primareacutical, groundrut cakes, my carry of the company of t

dates, Makhana (foxmut) and all other groceny products and agri related products.

3. To carry on the business in India or elsewhere as buyers, sellers, memorand, exporter, importer, traders, agents, dealers, distributors, commission agents, brokers, stocklest, preservers, factors, corsignors, manufacturers representative, job worker, assembler, manufacturers, representative, job worker, assembler, repairers, facilitators, hirer, leaserbolder, clearing and shipping facilitators, custom house facilitators, war fingers, charders hirers, superintendents, representative, facilitators as service products for laising and clearing service for and otherwise deal in all kinds, classes, size nature and description of industrial, commercial, consumer capital goods, item.

3. A copy of the draft memorandum & articles of association of the proposed company may be inspected at the office at 1.2, 169, Shakif Mandiliquar (Foad, Juni Shankali, Illigae, Jetpur, Rajkot-Sagor).

4. Notice is hereby given that any person objecting to this application may communicate their objection in writing to the Registrat at Central Registration Centre (CRC), indian institute of Corporate Affairs (ICA).

Codes -122056, within twenty one days from the date of publication of this notice, with a copy at its registered office.

Dated this 20 th Day of July, 2024 Name(s) of Applicant (1) Jagdish Padariya (2) Nikunj Padariya (3) Ghanashyam Patoliya (4) Dewaj Hirapara (5) Anjanaben Gondaliya (6) Dharmishthaben Padariya(7) Kinjalben Padariya

Forex inflows from NRIs surge 4-

the most stable amo jtal foreign exchange reserves have jumped to a lifetime high of \$657.16 bil-lion during the week ended July 5.

Fold to \$2.7 bin in April-May

Mumbai, The money
from Indians working overseas that come into NRI deposits of banks surged more
han 4-fold to \$2.7 billion in
April-May his year compared
to \$0.6 billion in the same peiod last year, strengthening
the country's foreign extill forein exchange as the most stable among matief forein exchange. Mumbai, The money from Indians working over-seas that come into NRI deseas that come into NRI de-posits of banks surged more than 4-fold to \$2.7 billion in April-May this year compared to \$0.6 billion in the same pe-

to \$0.6 billion in the same pe-nod last year, strengthening the country's foreign ex-change reserves, the latest data compiled by the RBI showed. The total NRI de-posits as of May have now gone up to \$154.72 billion.

PUBLIC NO.

IN THE HIGH COURT OF GUIARAT AT AN AMEDABAD.

R/RECTIFICATION APPLICATION NO. 192 OF 202 Miles on 06/08/2024

Desirict: AHMEDABAD.

Mr. HEMAL SHAH, Ld. Advocate for the Applicant(s) AMEDICAN MARICO LIMITED

MARICO LIMITED

.....APPLICANT

2. MARCH DRAS NIGHT KISHOO SINGH MARDHOUT KI

lastly known to have actually and voluntarry looks (MOTICE that the hearing of the said R/RECTIFICATION APPLICATION NO 125/2022 will the place notified heapist, 2024 appearance is made on your behalf, your act for you it will be heard and determined in advocate or by someone authorised by low to act for you it will be heard and determined in Witness SUMTA-AGARWAL, Espaide the CHIEF JUSTICE at Ahmedabad aforesaid this 25th day of June, 2025 4. Say. 4. Say.

WESTERN RAILWAY- DAHOD SET OF AIR STRAINER TYPE-T

ADARSH PLANT PROTECT LIMITED

Regd. Office: 606, GDIC State, V. I. Nagar 3-881, Annali, Gajarit.
Tel No.: (2002) 236705, Fan No.: (2009) 236704
Website: www.adsriphatement. Email: adsriphatemetering imultous
NOTICE TO THE MEMBERS FOR 32rd ANNIAL GENERAL MEETING OF ADARSH PLANT
PROTECT LIMITER (Compusy) To BE HELD AT THE REGISTERED OFFICE 604, GIOC
ESTATE, V.L. NAGAR-388 121, ANANIA.

LeX Voting Services.

Mill commonsor on Wednesday, 11% September, 2024 at 09:00 a.m. (IST) and September, 2024 at 09:00 a.m. (IST) and September, 2024 at 09:00 p.m. (IST). for e-voting given in the notice of the ACM which will be available at a adardatimations) and IST's website (<u>xxxxx.besindinations</u>) and IST's website (<u>xxxxx.besindinations</u>). e electronic means. Hence notice of the AGM e as well. (https://www.evoting.nsdl.com/) see e-voting prior to the AGM can cast their v

દાહોદ એલસીબીએ આસાયડી હોટલ અને કેસરપુર ઘાટી ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો



(પ્રતિનિધિ) દાહોદ, મધ્યપ્રદેશના પેટલાવદ ગામે વિદેશી દારૂના ઠેકા પરથી સડેલી કાકડી તેમજ દૂધીના પોટલાઓની આડમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને વડોદરા પહોંચાડવા જઈ રહેલા બે ટેમ્પા ઇન્દોરથી ગોધરા તરફ જતા હાઈવે પર આસાયડી હોટલ આગળ દાહોદ એલસીબી પોલીસે પકડી પાડી બંને ટેમ્પાની અંદર કાકડી તેમજ દૂધીના પોટલાની આડમાં સંતાડેલ રૂપિયા ૧૬ લાખ ઉપરાંતની કિંમતનો વિર્દેશી દારૂનો જથ્થો ઝડપી પાડી સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ત્રણ લાખની કુલ કિંમતના બે ટેમ્પો તથા બે મોબાઈલ ફોન મળી રૂપિયા ૧૯,૧૭,૦૪૦/-ના મુદ્દા માલ સાથે બંને ટેમ્પાના ચાલકોની અટકાયત કરી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું

મધ્યપ્રદેશના પેટલાવદથી વિદેશી

અશોક લેલેન્ડના બે અલગ અલગ ટેમ્પોમાં દુધી તેમજ કાકડી જેવા શાકભાજીના પોટલાઓની પાછળ સંતાડીને વડોદરા ગોલ્ડન ચોકડી પર રાજુ નામના ઇસમને આપવા જઈ રહ્યા હોવાની બાતમી દાહોદ એલસીબી પોલીસને મળી હતી. જે બાતમીને આધારે દાહોદ એલસીબી પીએસઆઇ એમ.એલ ડામોર તથા તેમના સ્ટાફની ટીમ ઇન્દોર-ગોધરા હાઇવે પર અસાયડી હોટલ નજીક પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અસાઇડી હોટલથી થોડે દૂર એમપી.૧૧.જી-૪૦૩૮ તથા એમપીં૧ ૩જીબી -૦૨૪૬ એમ અશોક લેલેન્ડના બે ટેમ્પા ઉભા હતા. જેથી પોલીસે બંને ટેંપાને પકડી પાડી બંને ટેમ્પાના ચાલક મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રાજોડ ગામના મનોજ ઉર્ફે કાલુ મનસુખલાલ વર્મા તથા મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ગુંદીખેડા

દારૂનો જંગી જથ્થો એમપી પાસિંગના ગામના શંભુ ઉર્ફે બંટી રમેશભાઈ ચંડાલની અટકાયત કરી પોલીસે બંને ટેમ્પામાં કાકડી તથા દૂધી જેવા શાકભાજીના પોટલાની હોડમાં લઈ જવાતા ભારતીય બનાવટના રૂપિયા ૧૬,૦૭,૦૪૦/-કુલ કિંમતની વિદેશી દારૂની પેટીઓ નંગ-૨૪૮ માં ભરેલ બોટલ નંગ-૧૧૯૦૪ પકડી પાડી પકડાયેલ બંને ટેમ્પાના ચાલક પાસેથી રૂપિયા ૧૦,૦૦૦/- ની કુલ કિંમતના બે મોબાઈલ ફોન તથા દુધી તેમજ કાકડીના પોટલા વગેરે પકડી પાડી સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ત્રણ લાખની કુલ કિંમતના બે ટેંમ્પા મળી કુલ રૂપિયા ૧૯,૧૭,૦૪૦/

-નો મુદ્દામાલ કંબજે લીધો હતો.

દાહોદ એલસીબી પોલીસે કેસરપુર ઘાટી ગામેથી રૂ. ૨.૩૩ લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે ખોટી નંબર પ્લેટ વાળી hvundai કંપનીની ક્રેટા ગાડી પકડી પાડી કબજે લીધી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર જીજે ૨૭બી.એસ.૦૬૮૪ નંબરની hyundai કંપનીની ક્રેટા ગાડી વિદેશી દારૂનો જથ્થો ભરી ઝાલોદથી લીમખેડા તરફ આવતી હોવાની દાહોદ એલસીબી પોલીસને બાતમી મળી હતી. જે બાતમીને આધારે દાહોદ એલસીબી પોલીસની ટીમે ગતરોજ સવારે સાડા દસ વાગ્યાથી બપોરના અઢી વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન સિંગવડ તાલુકાના કેસરપુર ઘાટી ગામ નજીક રોડ પર જરૂરી વોંચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીમાં દર્શાવેલ નંબરવાળી હોન્ડાઈ કંપનીની creta ગાડી ત્યાંથી પસાર થતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કરતા ક્રેટા ગાડીના ચાલકે ગાડી ભગાવી મુકતા પોલીસે creta ગાડીનો

પીછો કરી ગાડીને ઓવરટેક કરી ગાડી ઉભી રાખવા ઈશારો કરતા ગાડીના ચાલકે થોડે દૂર જઈ ગાડી રસ્તાની સાઈડમાં ઉભી રાખી ગાડીનો દરવાજો ખોલી ચાલક ગાડીમાંથી ઉતરી કેસરપુર ઘાટીના જંગલના ઝાડી ઝાંખરામાં થઈ નાસી ગયો હતો. જે ક્રેટા ગાડી પોલીસે પકડી પાડી ગાડીની તલાસી લઈ ગાડીમાંથી રૂપિયા ૨,૩૩,૦૩૩/-ની કુલ કિંમતની વિદેશી દારૂની કુલ બોટલ નંગ-૪૯૯ પકડી પાડી સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ૧૦ લાખની કિંમતની હોન્ડાઈ કંપનીની ક્રેટા ગાડી મળી કુલ રૂપિયા ૧૨,૩૩,૦૩૦/-નો મુદ્દા માલ કબજે લઈ ગાડીની નંબર પ્લેટ ચકાસતા ગાડીની નંબર પ્લેટ પણ ખોટી હોઇ તેનો સાચી નંબર પ્લેટ તરીકે ઉપયોગ કર્યો હોવાનું જણાઈ આવ્યું હતું. આ સંબંધે ક્રેટા ગાડીના નાસી ગર્યેલા ચાલક વિરુદ્ધ રંધીકપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આમ આમ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડના ચક્રો

જેતપુરમાં દારૂના ગુનામાં પાંચ મહિનાથી ફરાર આરોપી ઝબ્બે

ગતિમાન કર્યા છે.

જેતપુરઃ જેતપુર સીટી પોલીસ સ્ટેશનના પ્રોહીબીંશનના ગુનામા પાંચ મહીનાથી ફરાર આરોપી ચીરાગ ઉર્ફે કાળુ કેશુ બોરડા હાલ રહે. સુરત, મુળ ગારીયાધારના વદરને પોલીસે પકડી પાડયો હતો. આરોપી સુરત અને સાવરકુંડલામાં પણ ગુના આચરી ચુકયો હતો.

ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

(પ્રતિનિધિ) નડિયાદ, ૧૧૨૦૪૦૧૭૨૨૦૧૦૮/૨૦૨૨ પોલીસ અધિક્ષક ખેડા-નડીયાર્દ ઇ.પી.કો. કલમ ૩૮૦ મુજબના કામનો નાઓએ ખેડા નડીયાદ જીલ્લામાં નાસતા ફરતા આરોપીએને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ ઉત્તરસંડા તા.નડીયાદ જી.ખેડા નાનો સ્પેશીયલ ડ્રાઇવ આપેલ

હોય ના.પો.અધિ.સા નડીયાદ ડીવીઝન નાઓએ આગામી સમયમાં ગુરુ પુર્ણીમાં આવતી હોય જેથી કાયદો અને વ્યવસ્થા જળવાય તે અનુસંધાને મિલ્કત/શરીર સબંધી ગુનાઓ અટકાવવા તથા

આવા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી તેઓના વિરુધ્ધ જરૂરી કાર્યવાહી કરવા સારૂ જરૂરી સુચનાઓ આપેલ હોય જે આધારે વડતાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.દેસાઇ નાઓએ સર્વેલન્સ ટીમના માણસોને અસરકારક પેટ્રોલીંગ રાખી નાસતા ફરતા આરોપીઓને પકડી ગુનાઓ અટકાવવા સારૂ જરૂરી સુચનાઓ આપેલ દરમ્યાને વડેતાલ પોલીસ સ્ટેશનના માણસો સાથે વડતાલ પો.સ્ટે. સ્ટેશનના



વિસ્તારમાં પેટ્રાંલીંગમાં હતા દરમ્યાન નાસતા-ફરતા હાવાનુ જણાવતા હાય અ.પો.કો. વિષ્ણુભાઇ તથા જેથી તેને ઉપરોક્ત ગુનાના કામે પકડી આકાશકુમાર નાઓને સંયુક્ત બાતમી BNSS કલમ ૩૫ (જે) મુજબ અટક હિકિકત મળેલ કે, ચકલાસી પોલીસ કરી ચકલાસી પોલીસ સ્ટેશન વધુ ગુ.૨જી.નં. કાર્યવાહી માટે સોંપેલ છે.



(તસ્વીર:-હસંમુખ પંચાલ,ખેડબ્રહ્મા)

અમદાવાદીઓને પેટ પકડીને હસાવતું

અમદાવાદીઓને ખરેખર ઘેલું

લગાવે તેવું નાટક એટલે ''વિદેશી વહુ, તને શું કહું" નો અત્યંત ટૂંકા દિગ્દર્શિત આ નાટક વિદેશી વહુ તને ગાળામાં જ ૬૨મો રેકોર્ડ બ્રેશ

શહે રના ઠાકો રભાઈ દેસાઈ હોલમાં યોજાયો હતો હાસ્યની નોન સ્ટોપ ધમાચકડી જેવા આ નાટ્ય શોના એક એક કલાકારો ભારે

દાદ માંગી લે તેવા કાબિલે દાદ અભિનયના અજવાળા પાથરનારા સાબિત થાય તેમ છે. સિંહણ જેવી કાઠીયાવાડી સાસુને પડકારતી અમેરિકન વહુ ભારે તોફાની હોવાની સાથે સાથે બિલકુલ સહજરીતે અર્થના જે પ્રકારે અનર્થ કરે છે તે પ્રેક્ષકોમાં ભારે હાસ્યની છોળો ઉડાડે છે.

જાણીતા નિર્માણકાર વિવેક શાહ પ્રસ્તુત તેમજ ચિન્મય પંડચા (અધિકારી) અને બકુલ પરમાર

નાસતો ફરતો આરોપી જીતુભાઇ ઇશ્વરભાઇ પરમાર રહે. પુનમપુરા તાબે હાલ ઉત્તરસંડા

ચોકડી આવનાર છે અને તેણે શરીરે આછા ગુલાબી તેમાં મરુન તથા વાદળી પટ્ટા વાળી ટીશર્ટ તથા ગ્રે કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ છે. જે બાતમી હકિકત આધારે સુંદર ઇસમની વોચ તપાસમાં રહી

ઉપરોકત બાતમી હકિકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતા એક ઇસમ બાતમીના વર્શન મુજબના કપડા પેહેરેલ ઉભો હતો જેની ઉપર શક જતા તેને સ્થળ ઉપર રોકી લઇ પુછપરછ કરતા ગલ્લા તલ્લા કરી કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી અને સદર ઇસમને વિશ્વાસમાં લઇ પુછતા જણાવેલ કે, પોતે ચકલાસી પોલીસ સ્ટેશનના ગુ.રજી.નં. 112080 19220106/2022 ઇ.પી.કો. કલમ ૩૮૦ મુજબના ગુનાનો નાસતો-ફરતો હોવાનુ જણાવતો હોય



ખેડબ્રહ્માપંથકમાંગામેગામગૌરીવ્રતનોપ્રારંભથયોછે.બેદિવસપહેલા નાનીગોરોશરૂથઈહતી.આજથીમોટીગોરોશરૂથઈછે.મનગમતાપતિ અનેસુખાકારીમાટેબાળાઓદ્વારાઆવ્રતકરાયછે.ખેડબ્રહ્માશહેરના નવા મારવાડામાં આવેલ સોમનાથ મહાદેવ મંદિરે પુજારી રમેશભાઈ શંકરભાઈ વ્યાસ દ્વારા સમૂહમાં બાળાઓને પૂજા કરોવાઈ હતી .

નાટક એટલે વિદેશી વહુ તને શું કહું

અમદાવાદ, ધ્વારા સહપ્રસ્તુત ઋષિકેશ ઠકકર અને સંદીપ વ્યાસ ધ્વારા લિખિત અને નીશીથ કુમાર બ્રહ્મભટ્ટ ધ્વારા

કલાક સુધી સતત પ્રેક્ષકોને જકડી રાખે છે. 3 c 5 6 5

ક્લાકારોમાં પોતાના પાત્રોને સુપેરે રજૂ કરે કરનાર ચાર્મી કેલૈયા, પ્રશાંત સુખડીયા,

કરિશ્મા પાટડીયા, સત્યમ જોશી, કેતન ચૌધરી અને પૃથ્વી પાટીલે પોતાની જન રેડીને અભિનયના ઓજસ પાથર્યા છે. માનવી માનવી વચ્ચેની લાગણી અને સાસુ ખતરામાં આવતા જ વહુ પોતાનાથી બનતું બધું જુ કરી છુટીને કેવી રીતે આવનારા એધાણને ઓળખીને પોતાની સાસુ માટે ઢાળ બનીને ઉભી રહે છે અને પોતાના પરિવારના અસ્તિત્વ ઉપર આવનારી આફતને સિફતપૂર્વક ટાળે છે તે જ દર્શાવે છે કે, પરિવાર છે તો બધું જ છે.

🐧 પશ્ચિમ રેલ્વે-દાહોદ

ટી-ટાઇપનો એર સ્ટ્રેનર સેટ Sr.DyCMM/DHD, પશ્ચિમ રેલ્વે, દાહોદ, IREPS 2-32 -142 89288000 આમંત્રિત કરે છે, તા. નીચેના કામ માટે ૦૩/ ૦૮/૨૦૨૪. જો ખોલવાની તારીખ બંધ અથવા રજા હોય, તો ટેન્ડર તે જ સમયે તે પછીના કામકાજના દિવસે ખોલવામાં આવશે. **કામનું ын:** CLW Drg મુજબ એર સ્ટ્રેનર પ્રકાર-Tનો સેટ. નંબર **0/2/65/440** Al**t-0**, સ્પેકને અનુરૂપ. નંબર CLW/TS/99-90/ 0014. સમૂહ-૨નો સમાવેશ કરે છે આઇટમ ૨૦ નંગ નીર્ચે મુજબ છેઃ (i) 1/2" BSP = ૧૫ નંગ (ii) 3/8" BSP – ૦૫ નંગ. જથ્થોઃ ૮૦ સેટ. કામની અંદાજિત કિંમતઃ ૪૦,૧૨,૦૦૦/- (બધા કર સહિત). **અર્નેસ્ટ** मनीः २,००,६००/-. <mark>કરારની અવધ</mark>િः ६० દિવસ. ઇ-ટેન્ડર દસ્તાવેજ સબમિટ કરવાનો <mark>સમચ અને તારીખઃ</mark> ૦૩/૦૮/૨૦૨૪ ના રોજ ૧૧:૦૦ કલાક સુધી.ઇ-ટેન્ડર ખોલવાનો સમય અને તારીખઃ ટેન્ડર ભરવાની અંતિમ તારીખ પછી. ઓફિસનું સરનામું જ્યાંથી ટેન્ડર ખોલવામાં આવ્યું છેઃ Sr.DyCMMની ઓફિસ, પશ્ચિમ રેલવે, દાહોદ. શરૂઆતની તારીખથી ઓફરની માન્યતાઃ ૯૦ દિવસ. વેબસાઇટ વિગતો અને નોટિસ બોર્ડ સ્થાન ક્રેન્ડર દસ્તાવેજો પણ હોઈ શકે છે. IREPS વેબસાઇટ https://www.ireps.gov.in પરથી ડાઉનલોડ કરો. ટેન્ડરર દ્વારા જરૂરી અન્ય કોઈપણ માહિતી કામકાજના કલાકો દરમિયાન Sr.DyCMM/DHDની ઓફિસમાંથી મુખ્ય વર્કશોપ મેનેજર જી-૧

ક કરો : f facebook.com/WesternRly

🕼 પશ્ચિમ રેલ્વે-દાહોદ

બ્રેકિંગ એક્સિટેશન ટ્રાન્સફોર્મર Sr.DyCMM/DHD, પશ્ચિમ રેલ્વે, દાહોદ, IREPS ટેન્ડર નંબર કવર૪૫૫૩૫ બંધ તા નીચેના કામ માટે ૦૮/૦૮/૨૦૨૪ આમંત્રિત કરે છે. . જો ખોલવાની તારીખ બંધ અથવા રજા હોય, તો ટેન્ડર તે જ સમયે તે પછીના કામકાજના દિવસે ખોલવામાં આવશે. **કામનું નામઃ** CLW સ્પેકન મુજબ બ્રેકિંગ એક્સિટેશન ટ્રાન્સફોર્મર (ATFEX) ૬૦ KVA. કોઈ CLW/ES/T ૨૦ Alt.-H. જથ્થોઃ ૧૨ નંગ કામની અંદાજિત કિંમતઃ ૩૧,૭૧,૮૪૦/- (બધા કર સહિત). અ**ર્નેસ્ટ મનીઃ** ૧૫૮,૫૯૨/-. કરારની અવધિઃ हुए हिवस, ध-डेन्डर हस्तावेष सलमिड **કરવાનો સમય અને તારીખ:** OZ/OZ/२०२४ ના રોજ ૧૧:૦૦ કલાક સુધી. ઇ-ટેન્ડર ખોલવાનો સમય અને તારીખઃ ટેન્ડર ભરવાની અંતિમ તારીખ પછી. ઓફિસનું સરનામું જ્યાંથી ટેન્ડર ખોલવામાં આવ્યું છેઃ Dy.CMMની ઓફિસ, પશ્ચિમ રેલવે, દાહોદ. **શરૂઆતની** તારીખથી ઓફરની માન્યતાઃ ૯૦ દિવસ વેબસાઇટ વિગતો અને નોટિસ બોર્ડ સ્થાન ટેન્ડર દસ્તાવેજો પણ હોઈ શકે છે. IREPS વેબસાઇટ https://www.ireps.gov.in પરથી ડાઉનલોડ કરો. ટેન્ડરર દ્વારા જરૂરી અન્ય કોઈપણ માહિતી કામકાજના કલાકો દરમિયાન Sr.DyCMM/DHDની ઓફિસમાંથી મેળવી શકાય છે.

SNP-152 สเฮร ธร) : 🔃 facebook.com/WesternRly

ફોર્મ નંબર ચુઆરસી-૨

અધિનિયમના XXI પ્રકરણના ભાગ I હેઠળ નોંધણી વિશે સૂચના આપતી જાહેરાત. [કંપની અધિનિયમ, 2013 નીકલમ 374(b) અને કંપનીઓના નિયમ 4(1)ને અનુસરીને (નોંધણી માટે અધિકૃત) નિયમો, 2014]

<mark>૧.</mark> આથી સૂચના આપવામાં આવે છે કે કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૩૬૬ ની પેટા-કલમ (૨) ના અનસંધાનમાં, ગજરાત ખાતેના રજિસ્ટારને અરજી કરવામાં આવી છે કે M/S શ્રીજી એગ્રી ઇમ્પેક્સ, ભાગીદારી પેઢી રજીસ્ટર થઈ શકે છે. કંપની એક્ટ ૨૦૧૩ ના પ્રકરણ XXI નાભાગ I હેઠળ, શેર દ્વારા મર્યાદિત કંપની તરીકે.

<mark>૨. કંપનીના મુખ્ય હેતુઓ નીચે મુજબ છે</mark> :-

(૧) ખાદ્ય અને અખાદ્ય તેલ, તેલીબિયાં, બ્રાન્સના ઉત્પાદન, ઉત્પાદન, વાવેતર, વૃદ્ધિ, ખેતી, પુનઃ ભરવા, આયાત, નિકાસ, ખરીદી, વેચાણ, પ્રક્રિયા, તૈયાર, ક્રશ અને અન્યથા વેપાર કરવા માટેનો વ્યવસાય ચાલુ રાખવા માટે, એરંડા અને તેલની કોઈપણ પ્રકારની અને કોઈપણ પ્રકારની કેક, જેમાં લીંટર, હલએક્સપેલર ઓઈલ કેક, ડી-ઓઈલ્ડ કેક, કઠણ તેલ, વનસ્પતિ ઘી, માર્જિન, ખાદ્ય પ્રોટીન, એરંડાનું તેલ, આલ્કલી રિફાઈન્ડ અળસીનું તેલ, ઔદ્યોગિક તેલ, અળસીનું નિષ્કર્ષણ, કપાસના બીજ, મગફળીનું તેલ, ખાતર મિશ્રણ, હાઇડ્રોજન યુક્ત એરંડા તેલ, તેલ અને ફાર્માસ્યુટિકલ, સીંગ દાણાની કેક, માયરાબોલમ અને બદામના બીજનું તેલ અને ખનિજ તેલ.

(૨) ઉત્પાદન, વેપાર, આયાત, નિકાસ, ખરીદો, વેચાણ, પ્રિઝર્વર્સ, અલગ, પેક, રીપેક, પરિવહન, સ્ટોર, ફોરવર્ડ, વિતરણ, વિકાસ, હેન્ડલ, તૈયાર, ક્રશ, ગ્રાઇન્ડ, મિશ્રણ, પોલિશ તમામ પ્રકારના, જાતો, સ્વરૂપો, કઠોળ, દાળ, દાળ, કઠોળ, અનાજ, ક્ષાર, અનાજ, ગોળ, સૂકા ફળો, દૂધમાંથી ઉત્પાદનો અને અન્ય ડેરી ઉત્પાદનો અને મસાલાઓ સહિત તમામ પ્રકારના સોર્ટેક્સ, સ્વચ્છ, સુધારણા, પ્રક્રિયા અને વ્યવહાર કરો. પરંતુ ઘઉં, ચોખા, ચણા, તુવેરદાળ, બાજરી, મગફળીના દાણા, પીનટ બટર, સાબુદાણા, કેરમસીડ, તલ (કાળા અને પીળા) સુધી મર્યાદિત નથી. ધાણા, કેસર, મેથી, એલચી, વરિયાળી, તજ પાવડર, સરસવના દાણા, મરચાં, મરચાંનો પાવડર, મરી, લવિંગ, જીરું, જીરું પાવડર, ધાણા, ધાણા પાવડર, હળદર, હળદર પાવડર, અથાણું, હિંગ, સૂકા આદુનો પાવડર, સૂકા કેરીનો પાવડર, સોનફ, ગાયનુંઘી, ભેંસનુંઘી, દૂધનો પાવડર, ખાંડ, દૂધમાંથી મેળવેલા અન્ય ઉત્પાદનો, તમામ પ્રકારના ગરમ મસાલા, વિવિધ પ્રકારના અન્ય મેસાલા, જડીબુટ્ટીઓ, સીઝનીંગ, બદામ, કાજુ, કિસમિસ, પિસ્તા, જરદાળુ, સૂકા અંજીર, અખરોટ, ક્રેનબેરી, ખજૂર, મખાના (ફોક્સનટ⁾ અને અન્ય

તમામ કરિયાણા ઉત્પાદનો અને કૃષિ સંબંધિત ઉત્પાદનો. (૩) ભારતમાં અથવા અન્ય ખરીદદાર, વિક્રેતા, વેપારી, નિકાસકાર, આયાતકાર, વેપારીઓ, બેજન્ટો, ડીલરો, વિતરકો, કમિશન એજન્ટો, દલાલો, સ્ટોકીસ્ટ, પ્રિઝર્વર્સ, ફેક્ટર્સ, કન્સાઇનર્સ, સહયોગીઓ, ફ્રેન્ચાઇઝર્સ, કન્સેશનર, કન્સલ્ટન્ટ તરીકે વ્યવસાય ચાલુ રાખવા માટે , સલાહકારો, ઉત્પાદકો, ઉત્પાદકોના પ્રતિનિધિ, જોબવર્કર, એસેમ્બલર, રિપેરર્સ, ફેસિલિટેટર, ભાડે લેનાર, લીઝ ધારક, ક્લીયરિંગ અને શિપિંગ ફેસિલિટેટર, કસ્ટમ હાઉસ ફેસિલિટેટર્સ, વ્હાર્ફિંગર્સ, ચાર્ટર્સ ભાડે રાખનારા, સુપરિન્ટેન્ડન્ટ્સ, પ્રતિનિધિ, ફેસિલિટેટર બને સર્વિસ પ્રોવાઈડર્સ અને ક્લિયરિંગ સર્વિસ માટે અન્યથા તમામ પ્રકારના, વર્ગો, કદન<u>ી</u> પ્રકૃતિ અને ઔદ્યોગિક, વ્યાપારી, ઉપભોક્તા કેપિટલ ગુડ્સ, વસ્તુઓ, વસ્તુઓ, લેખો, કોમોડિટીઝ, મર્ચેન્ડાઇઝ, ઉત્પાદનો અને સંલગ્ન પ્રવૃત્તિઓના વર્શનમાં વ્યવહાર કરો.

<mark>૩. સૂચિત કંપનીના ડ્રાફ્ટ મેમોરેન્ડમ અને આર્ટિકલ્સ ઓફ એસોસિએશનની નકલ ૧</mark>૨ ૧૬૯, શાકલી માંડલીકપુર રોડ, જુનીશંખલી, ગામ, જેતપુર, રાજકોટ-૩૬૦૩૭૦ ખાતેની ઓફિસમાં તપાસવામાં આવી શકે છે.

<mark>૪.</mark> આથી સૂચના આપવામાં આવે છે કે આ અરજી સામે વાંધો ઉઠાવનાર કોઈપણ વ્યક્તિ પોતાનો વાંધો સેન્ટ્રલ રજિસ્ટ્રેશન સેન્ટર (CRC) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ કોર્પોરેટ અફેર્સ (IICA), પ્લોટ નંબર ૬,૭,૮, સેક્ટર પ ખાતેના રજિસ્ટ્રારને લેખિતમાં જણાવી શકે છે., IMT, માનેસર, જિલ્લો ગુડગાંવ (હરિયાણા), પિનકોડ- ૧૨૨૦૫૦, આ નોટિસના પ્રકાશનની તારીખથી એકવીસ દિવસની અંદર, તેની નોંધાયેલ ઓફિસમાં એક નકલ સાથે. તા. ૨૦જુલાઈ, ૨૦૨૪ ના દિવસે

અરજદારનું નામ : (૧) જગદીશ પાદરીયા (૨) નિકુંજ પાદરીયા (૩) ઘનશ્યામ પટોળીયા (૪) દેવરાજ હીરાપરા (૫) અંજનાબેન ગોંડલીયા (૬) ધર્મિષ્ઠાબેન પાદરીયા (૭) કિંજલબેન પાદરીયા

કોંગ્રેસે બજેટ સત્રમાં સરકારને ઘેરવાની તૈયારી કરી, રાહુલ ગાંધીએ એક્શન પ્લાન બનાવ્યો

કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો એક્શન પ્લાન

બજેટ સંત્રમાં સરકારને ઘેરવા માટે તૈયાર છે. રાહુલ ગાંધીનું ફોકસ યુવાનો, ખેડૂતો-મજૂરો, સૈનિકોની સાથે સામાન્ય લોકો એને ગરીબો પર રહેશે. ૨૨ જુલાઈથી શરૂ થઈ રહેલા બજેટ સંત્ર પહેલા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકારને ઘેરવા માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. આ અંતર્ગત સામાન્ય ગરીબ લોકો, વધતી જતી મોંઘવારી અને ઘટતી કમાણી, યુવા બેરોજગારી

ખેડબ્રહ્મા તાલુકા બાર ગોળ ઠાકોર સમાજના નવા વરાચેલા પ્રમુખનો વિરોધ

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા તાલુકા તથા આસપાસના ગામોમાં રહેતા ઠાકોર સમાજની એક મીટીંગ તારીખ ૧૯ 🕼 જલાઈ ૨૦૨૪ ના રોજ ખેડબ્રહ્મા શહેરમાં અંબિકા માતાજી મંદિરમાં મળી હતી. આ મિટિંગમાં નવા પ્રમુખ પદે ચૌહાણ અર્જીનભાઈ સોમાભાઈની વર્શી કરાઈ હતી. ત્યારે સમાજના અમુક લોકોએ નવા પ્રમુખ નો વિરોધ કર્યો હતો અને વિરોધ કરનાર લોકો ના મતે નવા પ્રમુખે સમાજના અમુક લોકોને ગેરમાર્ગે દોરી, પૈસા ખવડાવી, બહાર ફરવા લઈ જઈ રાજકારણ રમી સમાજના પ્રમુખ બની બેઠા છે. આવા પૈસા ખવડાવી પ્રમુખ બનનાર સમાજનું ભલું ન કરી શકે માટે નવેસરથી સમાજની ફરી મિટિંગ બોલાવી સમાજના આગેવાનો વડીલો અને યુવાનોની હાજરીમાં સમસ્ત બારગોળ સમાજના પ્રમુખની વરણી કરવી જોઈએ તેવી સંભાવના પ્રમુખને ઉદ્દેશી અરજી

अने स्वामिनाथन समितिनी केवा मुद्दा ઉઠाववानी तैयारी

તેમજ વિપક્ષ આ મુદ્દે પ્રાઈવેટ મેમ્બર બિલ લાવીને સરકારને અલગ કરવાનો પ્રયાસ કરશે. કોંગ્રેસ લોકસભામાં સત્ર દરમિયાન કામદારોનું લઘુત્તમ વેતન વધારીને ૪૦૦ રૂપિયા કરવાની માંગ કરશે. સાથે જે કોંગ્રેસ સૈનિકો માટેની અગ્નિવીર યોજના બંધ કરવાની

લેસ્ટર્ને ટાઇમ્સ

જાહેરાતો અંગે વાંચકોએ પોતાની રીતે ચકાસણી કરી

પશ્ચિમ રેલ્વે-રતલામ

સિનિયર ડિવિઝનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર ટ્રેક્શન ડિસ્ટ્રિબ્યુશન, વેસ્ટર્ન રેલવે, રતલામ નીચેના કામ માટે ઈ-ટેન્ડર આમંત્રિત કરે છે ટેન્ડર નંબર : EL/TRD/58/2024-25/01RT. તારીખઃ ૧૭/૦૭/૨૦૨૪. કામનું નામઃ વિવિધ એસએન્ડટી સાથે જોડાણમાં ટીઓરડી કાર્ય રતલામ વિભાગ. કામની <mark>અંદાજિત કિંમતઃ ૧,૪૧,</mark>૯૩,૭૫૯.૫૦/-. બાનું નાણાં જમા બિડ સુરક્ષા : રૂા.૨,૨૧,૦૦૦/-. સમાપ્તિ અવધિઃ ૧૨ . માસ. **ટેન્ડર દસ્તાવેજની ક્લિંમતઃ** શૂન્ય. સમાપ્તિ તારીખ અને સમય ૧૨.૦૮.૨૦૨૪ **૧૫:૦૦ કલાકે.** ઓફરની માન્યતાઃ ખોલવાની તારીખથી ૬૦ દિવસ. **વેબસાઇટ વિગતો**: www.ireps.gov.in. નોટિસ બોર્ડનું સ્થાનઃ સિનિયર ડિવિઝનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર (ટ્રેક્શન ડિસ્ટ્રિબ્યુશન), વેસ્ટર્ન રેલવે, રતલામ - ૪૫૭૦૦૧ની ઑફિસની

કરવામાં આવી રહી છે.

વેસ્ટર્ન ટાઇમ્સમાં પ્રકાશિત નિર્ણય લેવો.

-જાહેરખબર મેનેજર

ટીઆરડી વર્સ

Sr.DEE/TRD/RTM લાઇક કરો : **f** facebook.com/We<u>stern</u>

પશ્ચિમ રેલવે-રાજકોટ ડિવિઝન

<u>વ્યાપક વાર્ષિક જાળવણી કરાર</u> 1. <u>ઈ-ટેન્ડર નોટિસ નં.</u>: DRM-RJT-24-25-SnT-E-09 તા. 12/07/2024; ઓફિસન્ <u>સરનામું</u>: ડિવિઝનલ રેલવે મેનેજર (એસ એન્ડ ટી), પશ્ચિમ રેલવે, કોઠી કમ્પાઉન્ડ, રાજકોટ - 360001 વેબસાઇટ ની વિગત: www.ireps.gov.in; ટેન્ડર નં.: DRM-RJT-24-25-SnT-E-09 તા. 12/07/2024; કામનું નામ: રાજકોટ ડિવિઝન: મેધા (વાણી રોડ (વીએનઆરડી) - બાલા રોડ (બીએલઆરડી) સેક્શન) રાજકોટ ડિવિઝનન વાણી રોડ (વીએનઆરડી) - બાલા રોડ (બીએલઆરડી) સેક્શનમાં 08 સ્ટેશનો પર ઈલેક્ટ્રોનિક ઇન્ટરલોર્કિંગ સિસ્ટમ (મેધા મેક) મોડલ MEI633 માટે વ્યાપક વાર્ષિક જાળવર્ણ કરારની જોગવાઈનું ત્રણ વર્ષ માટે નવીકરણ.; <u>ટેન્ડરનો અંદાજીત ખર્</u>ય: ₹ 2,18,58,341.76 (ક બે કરોડ અઢાર લાખ અફાવન હજાર ત્રણ સે એકતાળીસ અને છોત્તેર પૈસા માત્ર); **અર્નેસ્ટમની** ડિપોઝીટ: ₹ 2,59,300/- (₹ બે લાખ ઓગણસાઈંઠ હજાર ત્રણસો માત્ર); <u>ટેન્ડર ફોર્</u>મ **ક્રી:** ₹ 00.00 (શૂન્ય) પેરા-3, GCC-જુલાઇ-2022 મુજબ; ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ

જાહેર સૂચના

અમને લાશક કरोः f facebook.com/WesternRly 🎗

અમદાવાદ મધ્યે ગુજરાતની ઉચ્ચ અદાલતમાં ૨જી. / સુધારા અ૨જી નં. ૧૯૨/૨૦૨૨ નિયત તારીખ: ૦₹/૦૮/૨૦૨૪ જિક્ષો:– અમદાવાદ

વિદ્રાન વકીલ શ્રી હેમલ શાહ અરજદાર (ઓ) તરફે મેરીકો લિમીટેડ

નરેન્દ્રસીંગ કીશોરસીંગ રાજપુરોહીત અને અન્યો મેસર્સ મનવાર પ્રોડક્ટ્સ તરીકે વ્યાપાર કરતા

૧. નરેન્દ્રસીંગ કીશોરસીંગ રાજપુરોહીત મેસર્સ મનવાર પ્રોડક્ટ્સ તરીકે વ્યાપાર કરતા

સરનામું - ૧૮/એલ/એલ, સત્તાધાર કોમ્પ્લેશ, સી.પી.નગ ચાર રસ્તા, ઘાટલોડીયા, અમદાવાદ-૩૮૦૦૬૧, ગુજરાત નોંધ લેશો કે ઉપરોક્ત નામના અરજદાર(ઓ)એ આ હાઈકો આર/સુધારા અરજી નંબર ૧૯૨/૨૦૨૨ (વ્યાપાર ચિ અધીનિયમ, ૧૯૯૯ની કલમ ૫૭ હેઠળ) રજૂ કરેલ છે. જે ન્રરેન્દ્રસિંહ કિશોરસિંહ રાજપુરોહિત કે જે – મેસર્સ મન

પ્રોડક્ટ્સના નામે વ્યાપાર કરતા હોય, ટ્રેડમાર્ક "મનવર લેખલ માટે વર્ગ ૦૩ માં નોંધણી ક્રમાંક-૨૦૦૪૬૦૩ માં સુધા કરવાની વિનંતી કરેલ છે. જ્યારે દીવાની અરજી (અવેજી સેવા માટે)નં. ૧/૨૦૨૪ સુનાવણી અને મંજૂરી આપવા પર આરસુધારા અરજી ૧૯૨/૨૦૨૨ ને માનનીય અદાલત (કોરમ: એડીશ્રલ રજીસ્ટ્ર (ત્યારિક)) તા. ૨૫/૦/૬/૦૦૨૪ ના રોજ હુકમ કરેલો કે જે નોટીસ બજેલ નથી તેવા પ્રતિવાદી નંબર ૧ ને સ્થાનિ સમાચારપત્રમાં અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં જાહેર સૂચ પ્રકાશિત કરીને નોટિસ જારી કરવાનો આદેશ આપ્યો છે, કે ત્રકાતાતા કરામ ત્યારત હતા કરવામાં આદમ અના છે. આસપાસના વિસ્તારમાં વ્યાપક પ્રસાર ધરાવતુ હોય અને ઉપરોક્ત નોટીસ નહી બજેલ પ્રતિવાદી નં.૧ છેલે ખરેખર સ્વેચ્છાએ વસવાટ કરતા હોવાનું જાણવા મળેલ હોય.

નોંધ લેશો કે ઉપરોક્ત રજી./ સુધારા અરજી ૧૯૨/૨૦૨૨ ની સુનાવલી **તારીખ ૦૬ ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ સવારે ૧</mark>૧:૦૦** વાગ્યે આ અદાલતમાં અનિર્ધિતપણે યોજાશે અને જો તમા કોઈ હાજરી આપવામાં નહીં આવે તો, તમારા વકીલ તમારા માટે કાર્યવાહી કરવા માટે કાર્યદા દ્વારા અધિક વ્યક્તિ દ્વારા તમારી ગેરહાજરીમાં તેની સુનાવણી અને l કરવામાં આવશે.

અમદાવાદ ખાતેના મુખ્ય ન્યાયમૂર્તીશ્રી સુનીતા અગ્ર સાક્ષ્યે, આજ રોજ તા.૨૫ મી જૂન, ૨૦૨૪ના દિવસે ઉ જણાવ્યું હતું. અદાલ (કે. એમ. સુતરીયા) આસીસ્ટન્ટ રજીસ્ટ્રાર

સરકારને ઘેરવાની તેયારી કરી રહી ભલામણોના આધારે લોન માફી છે. આ સિવાય કોંગ્રેસ જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાઓને ટાંકીને સેનાના જવાનોની શહાદતનો મુદ્દો પણ ઉઠાવશે અને સરકારની નીતિઓને નિષ્ફળ ગણાવશે. આ સાથે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા અને ચુંટણી કરાવવાને બદલે એલજીની સત્તા વધારવામાં આવે તો પણ સરકારને ઘેરવાની તૈયારીઓ ચાલી રહી છે. હકીકતમાં સરકારની નીતિઓને નિષ્ફળ ગણાવીને ભારતીય ગઠબંધન સાથે મળીને જમ્મુ-કાશ્મીર

, અને નીટ પેપર લીક, ખેડૂત- પણ ગૃહમાં માંગ કરશે. કોંગ્રેસ રહી છે. તે જ સમયે, મણિપુર, એમએસપી ગેરંટી, ટેકાના ભાવ સતત આ મુદ્દો ઉઠાવી રહી છે અને ત્રિપુરામાં હિંસા અને ચીનના અતિૅક્રમણનો મુદ્દો ઉઠાવીને સરકારને રાષ્ટ્રવાદના મુદ્દે બેકફૂટ પર મૂકવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તમને જેણાવી દઈએ કે લોકસભા ચૂંટણી બાદ રાહુલ ગાંધીએ મણિપુરના હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને શરણાર્થી શિબિરોમાં આશરો લઈ રહેલા લોકોને મળ્યા હતા. હવે કોંગ્રેસ આ મુદ્દો સંસદમાં ઉઠાવવાની તૈયારી કરી રહી છે. એકંદરે, રાહુલ ગાંધીએ આવા મુદ્દાઓ દ્વારા સમાજના વિવિધ વર્ગોને અપીલ કરીને સરકારને આડે હાથ લેવાની તૈયારી કરી છે, જ્યારે સરકાર પણ ડેટા સાથે વળતો પ્રહાર પર હુમલો કરવાની તૈયારીઓ ચાલી કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

શ્રી ભાગવત વિદ્યાપીઠ બી. એડ્. કોલેજ, સોલા અમદાવાદ ભરતી માટેની જાહેરાત

ગુજરાત સરકારશ્રી દ્વારા સ્થાપિત તેમજ યુ.જી.સી. માન્યતા પ્રાપ્ત શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટી, વેરાવળ સંલગ્ન (સ્વનિર્ભર) શ્રી ભાગવત વિદ્યાપીઠ બી.એડ્. કોલેજ, સોલા, અમદાવાદ માટે સંસ્કૃત માધ્યમમાં અધ્યાપન કરાવી શકે તેવા નીચે જણાવેલ જગ્યાઓ માટે ભારતીય નાગરિકો પાસેથી આવેદનપત્ર આમંત્રિત કરવામાં આવે છે

જગ્યાનું નામ :- (૧) આચાર્ચ -૧ (૨) આસી. પ્રોફેસર જગ્યા-૧ (વિષય :- સંસ્કૃત વ્યાકરણ-૧)

સૂચનાઓઃ (૧) નોકરી કરતા ઉમેદવારોએ સંસ્થાના વડા મારફત અરજે. મોકલવી. (૨) ઉમેદવારે પોતાની અરજી જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન- ૨૧માં સંપૂર્ણ વિગતો સાથે ૨જી.એ.ડી.થી, શ્રી ભાગવત વિદ્યાપીઠ બી.એડ્. કોલેજ, શ્રી ભાગવત વિદ્યાપીઠ બી.એડ્. કોલેજ, શ્રી ભાગવત વિદ્યાપીઠ, કૃષ્ણ ધામ, એસ.જી. હાઇવે, મુ. સોલા, અમદાવાદ ને મોકલવાની રહેશે, સમય મર્યાદા બાદ આવેલ અરજી અમાન્ય રહેશે.(૩) અરજી કરવા માટેનું નિયત નમુનાનું ફોર્મ તથા જરૂરી સૂચના www.sbvtbedcollege.org વેબસાઈટ પરથી મળશે.(૪) નિમણૂંક પામના૨ ઉમેદવા૨ને યુ.જી.સી./ સ૨કા૨શ્રી/ युनिवर्सिटी तेमल संस्थाना वजतोवजतना जंधा नियमो जंधनङर्ता

> કા. આચાર્ચ શ્રી ભાગવત વિદ્યાપીઠ બી.એડ્. કોલેજ મું .સોલા, અમદાવાદ

ADARSH PLANT PROTECT LIMITED CIN No.: L29210GJ1992PLC017845

Regd. Office: 604, GIDC Estate, V. U. Nagar – 388 121, Anand, Gujarat. Tel No.: (02692) 236705, Fax No.: (02692) 236704 Website: www.adarshplant.com Email: adarshplantprotect@gmail.com

NOTICE TO THE MEMBERS FOR 32nd ANNUAL GENERAL MEETING OF ADARSH PLANT PROTECT LIMITED (Company) TO BE HELD AT THE REGISTERED OFFICE 604, GIDC

ESTATE, V.U. NAGAR-388 121, ANAND.

1. Notice is hereby by given that the 32nd Annual General Meeting ('AGM') of the Company will be held physically on Saturday, the 14th day of September, 2024 at 11.00 a. M. (IST).

2. Pursuant to the above circulars, the Notice of the 32nd AGM, Standalone Financial Statements for the financial year 2023-24, along with Board's Report, Independent Auditors' Report and other documents required to be attached thereto, will be sent to the members whose email address are registered with the Company/Depository Participant(s). The aforesaid documents will also be available at Company's website (i.e. www.dasrablant.com and on the Bombay stock exchange's website where Company's securities are listed i.e. www.bseindia.com

3. The manner of casting vote through electronic mode:

a.) The Company is pleased to provide members the facility to exercise their right to vote on resolutions proposed to be considered at the 32nd Annual General Meeting by electronic means and the business may be transacted through e-Voting Services.

b.) The remote e-voting shall commence on Wednesday, 11th September, 2024 at 09:00 a.m. (IST) and shall end on Friday, 13th September, 2024 at 09:00 a.m. (IST) and shall end on Friday, 13th September, 2024 at 09:00 a.m. (IST) and shall end on Friday, 13th September, 2024 at 09:00 a.m. (IST) of Detailed instructions for e-voting given in the notice of the AGM which will be available at Company's website (www.adarabplant.com) and BSE's website (www.bseindia.com).

d.) The Company has engaged the services of NSDL as authorized e-voting agency and has made relevant arrangements with them for facilitating voting through electronic means. Hence notice of the AGM and e-voting instructions will be available at NSDL's website as well. (https://www.evoting.nsdl.com/)
e.) The members who have not cast their vote by remote e-voting prior to the AGM can cast their vote in

e.) The members who have not cast their vote by remote e-voting prior to the AGM can cast their vote in

AGM electronically.

4. The manner to get registered/updated email address:

a.) Kindly click/copy this link https://linkintime.co.in/EmailReg/EmailRegister.html and select your Company's name fill the mandatory details and update email Id and bank details in the given field, OR b.) Shares held in Demat mode: The shareholder can contact the Depository Participant ("DP") and register the email address and bank account details in the demat account as per the process followed and advised by the DP or by clicking above given link to update their details

5. The Register of Members and Share Transfer Book of the Company will remain closed from Sunday, 8th September, 2024 to Tuesday, 10th September, 2024 (both days inclusive) for the purpose of AGM. Cut-off date for the purpose of AGM is Saturday, 7th September, 2024.

6. The members are advised to go through all the notes carefully given in AGM notice for attending AGM and to cast their vote electronically.

For & on behalf of the Plant Protect Limite Managing Director Date: 17th July, 2024 Place: V. U. Nagar

ADARSH PLANT PROTECT LIMITED

Regd. Office: 604, GIDC, VITTHAL UDYOGNAGAR - 388 121, DIST. ANAND CIN No. L29210GJ1992PLC017845 Website : www.ada Tel No. (02692) 236705 Fax No. (02692) 236704 Email ID : adarshplantprotect@gmail.cor Extract of Audited Standalone Financial Results for the quarter ended 30th June, 2024

Year ended 31/03/2024 30/06/2024 Particulars 30/06/202 Audited 1865.18 Un-audited Un-audited let Profit / (Loss) for the period (before Tax, exceptional and/or Extraordinary items) 48.60 Net Profit / (Loss) for the period before tax (after 7.67 48.60 -16.80 et Profit / (Loss) for the period after tax (after otal Comprehensive Income for the period -16.80 7.67 48.60 Equity share capital arning per share (Face Value of Rs.10/- each)

NOTES:

1. The above results were reviewed and recommended by the Audit Committee and approved the Board of Directors in their meeting held on 17th July, 2024.

2. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements Regulations, 2015.

3. The full format of the Quarterly Financial Results are available on the website of the Stock Exchange www.bseindia.com and on the website of the Company www.adarshplant.com

4. Previous period's figures has been regrouped/ reclassified wherever required.

For Adarsh Plant Protect Lim

GUJARAT LEASE FINANCING LTD.

(CIN: L65990GJ1983PLC006345) Regd. Office: 6th Floor, Hasubhai Chambers, Opp: Town Hall, Ellisbridge Ahmedabad-380 006. Ph: 079-26575722, E-mail: glflho_ahm@yahoo.co.in, Website: www.gujaratleasefinancing.co.in

FOR THE QUARTER ENDED JUNE 30, 2024

(₹ in Lacs except per share data)

Note: The above is an extract of the detailed financial results for the quarter ended June 30, 2024 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015. The full format of the same, along with the notes, is available on the website of Stock Exchanges at www.bseindia.com and www.nseindia.com and also on the Company's website at www.gujaratleasefinancing.co.in.

Place: Ahmedabad Date: July 19, 2024

EXTRACT OF THE STATEMENT OF UN-AUDITED FINANCIAL RESULTS

Particulars	Quarter ended	Year ended	Quarter ended
	30.06.2024	31.03.2024	30.06.2023
	(Un-audited)	(Audited)	(Un-audited)
Total Income	10.27	48.01	10.15
Net Profit/(Loss) for the period before Tax and Extraordinary items	(6.16)	8.68	(6.28)
Net Profit/(Loss) for the period after Tax and Extraordinary items	(6.16)	8.68	(6.28)
Total Comprehensive Income for the period (after tax)	(4.15)	11.56	(6.46)
Equity Share Capital	2712.58	2712.58	2712.58
Reserves excluding Revaluation Reserve as per Balance Sheet	-	(3128.05)	_
Earnings Per Share (of ₹ 10/- each) Basic and Diluted	(0.02)	0.03	(0.02)
	Total Income Net Profit/(Loss) for the period before Tax and Extraordinary items Net Profit/(Loss) for the period after Tax and Extraordinary items Total Comprehensive Income for the period (after tax) Equity Share Capital Reserves excluding Revaluation Reserve as per Balance Sheet Earnings Per Share (of ₹ 10/- each)	Particulars ended 30.06.2024 (Un-audited) Total Income 10.27 Net Profit/(Loss) for the period before Tax and Extraordinary items Net Profit/(Loss) for the period after Tax and Extraordinary items (6.16) Total Comprehensive Income for the period (after tax) Equity Share Capital Reserves excluding Revaluation Reserve as per Balance Sheet Earnings Per Share (of ₹ 10/- each)	Particulars ended ended 30.06.2024 31.03.2024 (Un-audited) (Audited) Total Income 10.27 48.01 Net Profit/(Loss) for the period before Tax and Extraordinary items (6.16) 8.68 Net Profit/(Loss) for the period after Tax and Extraordinary items (4.15) 11.56 Total Comprehensive Income for the period (after tax) (4.15) 11.56 Equity Share Capital 2712.58 2712.58 Reserves excluding Revaluation Reserve as per Balance Sheet - (3128.05) Earnings Per Share (of ₹ 10/- each) (0.02) 0.03